

મહેસૂલ વિભાગના ઠરાવ કમાંક:- સીએલએસ/૧૦૨૦૧૨/૨૫૩/સ.૩,

તા.૨૦/૧૧/૨૦૨૧ માં ઉદ્દેખ કર્યા મુજબના અરજી ફોર્મનો નમુનો

૧	અરજદારની વિગત	
	નામ	
	ઉંમર	
	મૃતક સાથેનો સબંધ	
	રહેઠાંણનું સરનામું (પુરાવાની નકલ સામેલ રાખવી)	
	ધંધો (નોકરી/ધંધો/ખેતી/છુટકમજુરી/અન્ય)	
	મોબાઇલ નં.	
	આધાર કાર્ડ નં. (નકલ સામેલ રાખવી)	
૨	કોવિડ-૧૯(કોરોના)-થી મૃત્યુ પામનારની વિગત	
	નામ	
	ઉંમર	
	જાતિ (સ્ત્રી / પુરુષ)	
	મૃતકનો ધંધો (નોકરી/ધંધો/ખેતી/છુટકમજુરી/અન્ય)	
	રહેઠાંણનું સરનામું	
	આધાર કાર્ડ નં. (નકલ સામેલ રાખવી)	
	કોવિડ-૧૯(કોરોના) પોઝિટીવ આવ્યા તારીખ	
	કોવિડ-૧૯(કોરોના) થી મૃત્યુ પામ્યા તારીખ	
૩	મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબના પ્રમાણપત્રની નકલ જોડવી કે જેમાં મૃત્યુના કારણ તરીકે કોવિડ-૧૯(કોરોના) દર્શાવેલ હોવું જોઈએ.	પ્રમાણપત્ર જોડેલ છે? હા / ના

જ મૂલકના વારસદારની નામ-સરનામાં સાથેની વિગત	
પ સહાયની રકમ જો કોઈ એક વારસદારના નામે લેવાની હોય તેની વિગતો (એક કરતાં વધુ વારસદાર હોય તો અન્ય વારસદારોની સમંતિ સાથેનું એફિકેવીટ રજૂ કરવું)	એફિકેવીટ જોડેલ છે? હા / ના
ક જેનાં નામે સહાય લેવાની હોય તે વારસદારની બેંકની વિગતો (બેંક પાસબુકની નકલ સામેલ રાખવી)	બેંકનું નામ:- ખાતા નંબર:- ખાતા ધારકનું નામ:- IFSC કોડ:- બ્રાન્ચનું નામ:-

અરજદારની સહી :-

નામ:-

સ્થળ :-

તારીખ :-